



સુરત મહાનગરપાલિકા
મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ
આર.ટી.આઈ. એક્ટ-૨૦૦૫
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર (પી.એ.ડી.)
સને-૨૦૨૪

ઓફિસ ::—
મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ
ટાવર સામે , મેરીન રોડ,
સુરત.
ટેલીફોન નં .(૦૨૬૧) ૨૪૨૦૪૧૨

જાહેર માહિતી અધિકારી અને
સેક્રશન ઓફિસર
મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ
સુરત મહાનગરપાલિકા, સુરત.
ટેલીફોન નં .(ઓ.) : (૦૨૬૧) ૨૪૨૦૪૧૨
મો.નં. ૯૮૨૫૬૫૬૭૨૮

કલમ ૪(૧)બી(૧) : મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલની વ્યવસ્થાતંત્ર કાર્યો ફરજોની વિગત :

સુરત મહાનગરપાલિકા સંચાલિત મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે વિવિધ તબીબી સેવાઓ જેવી કે, તબીબી તપાસ, દવા, વિગેરે સામાન્ય દરે ઉપલબ્ધ છે. અંદાજે ૧૪૦ પથારી ધરાવતી મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલમાં રોજ સવારે ૦૮.૦૦ થી ૧:૦૦ તેમજ ૨.૦૦ થી ૫.૦૦ દરમ્યાન રાહત દરે (રૂ.૨૦.૦૦) તબીબી તપાસ ઉપલબ્ધ છે. જુદા જુદા તજશો ધ્વારા મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે દર્દીઓને જોઈ નિદાન પ્રમાણે સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સારવાર દવાઓ નજીવા દરે (૦૧ દિવસ ની દવાના રૂ.૧૦.૦૦ લેખે) જરૂરતમંદ દર્દીને આપવામાં આવે છે. હોસ્પિટલ ખાતે દાખલ કરવાપાત્ર દર્દીઓને દાખલ કરવામાં આવે છે. આ માટે હોસ્પિટલમાં જુદા જુદા વોર્ડની સુવિધા છે. વહીવટી અહેવાલ (૧૮) મુજબ હોસ્પિટલ ખાતે સર્જરી, ડાયાલીસીસ સારવાર, એક્ષ-રે પાડવાની કામગીરી તેમજ લોહી-પેશાબ વિગેરે તપાસણી અંગે લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાં નજીવા દરે જરૂરતમંદ દર્દીઓને લાભ આપવામાં આવે છે. વોર્ડમાં દાખલ ગરીબ દર્દીઓને સક્ષમ સત્તાધીશની ભલામણથી મહાનગરપાલિકાના મંજુર થયેલ નીતિનિયમો પ્રમાણે સારવારો મફત ઉપલબ્ધ કરવામાં આવે છે.

ઉપરોક્ત કામગીરી અંગે યોગ્ય વ્યવસ્થાતંત્ર ગોડવવામાં આવે છે. જેમાં મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે સીની. સ્થાનિક વૈ. અમલદારશ્રીના માર્ગદર્શન અને નિયંત્રણ હેઠળ માનદ તબીબો, જુની. મેડીકલ ઓફિસરો, નર્સો, કલાર્ક કમ કમ્પા. આસી., લેબોરેટરી ટેકનીશ્યનો, ડાયાલીસીસ ટેકનીશ્યનો, એક્ષ-રે ટેકનીશ્યનો, એસ.એસ.આઈ મુકાદમ, આયા, વોર્ડબોય, સફાઈ કામદારો હોસ્પિટલને લાગત સેવાઓ બજાવે છે. આ અંગે મેડીકલ, પેરામેડીકલ તથા કલેરીકલ સ્ટાફ મળી કુલ-૩૦૫ કર્મચારીઓનો સ્ટાફ મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે.

કલમ ૪(૧)(બી)(૨)મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલના અધિકારી/કર્મચારીઓની સત્તા અને ફરજો:

૧. સીની. સ્થાનિક વૈ. અમલદારશ્રી :—

૩. કમિશનરશ્રી(હેઠ્ય અને હોસ્પિ.) તથા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન અને હુકમ તેમજ સામાન્ય સભાએ મંજૂર કરેલ વિનિયમો પ્રમાણે અતિ આવશ્યક તબીબી સેવાઓ, તાકીદની સેવાઓ સામાન્ય સેવાઓ તેમજ હોસ્પિટલની સુવ્યવસ્થા તેઓશ્રીના સીધા નિયંત્રણ અને માર્ગદર્શન પ્રમાણે ચાલે છે.

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતાં પેરામેડીકલ સ્ટાફ, વહીવટી સ્ટાફ જેવા કે, મેડકીલ ઓફિસરો, નર્સો, કલાર્ક કમ કમ્પા. આસી., લેબોરેટરી ટેકનીશ્યનો, ડાયાલીસીસ ટેકનીશ્યનો, એક્ષ-રે ટેકનીશ્યનો, મુકાદમ, આયા, વોર્ડબોય, સફાઈ કામદારો, સેક્શન ઓફિસર, હેડ કલાર્ક, સીની.કલાર્ક વિગેરે તેઓની દેખરેખ હેઠળ ફરજ બજાવે છે. લેબર લોઝના કેસો તેમજ મેડીકલ લીગલ કેસ સહિતના તમામ હોસ્પિટલ રેકર્ડની વ્યવસ્થિત જાળવણી અને મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતેના મેડીકલ સ્ટોર્સ સીધી દેખરેખ હેઠળ છે. આર.ટી.આઈ.ના કેસોમાં અપીલ અધિકારી તરીકે જરૂરી કામગીરી બજાવવી તેમજ હોસ્પિટલને સંલગ્ન તમામ બાબતોની વેબસાઈટ પર જરૂરી ડેટા અપડેટ કરાવી તેની પર દેખરેખ રાખવી હોસ્પિટલનું જરૂરી સ્ટેટીકસ્ટીક્સ નિભાવી તેમાંથી જરૂરી ડેટાઓ નિયમિતપણે સબંધિત ખાતાને મોકલવા, કોર્પોરેશનના અન્ય ખાતામાંથી માંગવામાં આવેલી માહિતી એપ્પું કરાવી લાગત ખાતાને મોકલવી. બાયોમેડીકલ વેસ્ટને લાગત તમામ પ્રકારની કામગીરી તેમજ હોસ્પિટલને લગતી તમામ પ્રકારની કામગીરી ઉપર સીધી દેખરેખ રાખે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ અન્ય બાબતોમાં પણ એ હોસ્પિટલના નોડલ ઓફિસર તરીકે કામગીરી બજાવે છે. ઉપરાંત હોસ્પિટલના વડા અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૨. માનદ તબીબો :—

સીની. સ્થાનિક વૈ. અમલદારશ્રીના સીધા માર્ગદર્શન અને હુકમ પ્રમાણે મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલમાં કુલ-૨૭ માનદ તબીબો, દર અઠવાડીયે તેઓના નિર્ધારીત સમયે ઓ.પી.ડી.માં અને ઇમરજન્સીમાં સેવા આપે છે. માનદ સર્જનો ધ્વારા દર્દીના રોગના લક્ષણો પ્રમાણે જરૂરી સર્જરી હોસ્પિટલમાં કરવામાં આવે છે.

૩. પેથોલોજીસ્ટ :–

રોગ પરિક્ષણ માટે આવતા દર્દીઓનાં બ્લડ યુરીન વિગેરેની વિવિધ તપાસ લેબોરેટરી ટેકનીશ્યનો ધ્વારા કરાવી, રીપોર્ટ તૈયાર કરાવવા તેમજ જુદા જુદા મશીનોની સાચવણી કરવી અને તે માટે જરૂરી AMC , CMC આપવા અંગેના રીપોર્ટ તથા જરૂરી રીએજન્ટો મંગાવવાના રીપોર્ટ વિગેરે ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૪. મેડીકલ ઓફિસરો :–

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરો જુદા જુદા વોર્ડમાં શીફ્ટવાઈજ ફરજો બજાવે છે. તેઓની ફરજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જોઈ તપાસી તેમજ માનદ્ધ તજજી ધ્વારા પ્રિઝાઈઝ કરેલ સારવાર આપવાની છે. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરો દર્દીઓને જોઈ તપાસી રોગ, લક્ષણો મુજબ જરૂરિયાત પ્રમાણેની દવાઓ લખી જરૂરી સારવાર આપવામાં આપે છે, જરૂર જણાય તો મેડીકલ સાઈડના કેસો એટલે કે ડાયાબીટીસ, બ્લડપ્રેશર, હાર્ટની બિમારી વિગેરે અંગે હોસ્પિટલમાં દરરોજ આવતા જુદા જુદા માનદ્ધ ફિઝીશ્યનોને બતાવી/તપાસાવી તેમની સલાહ મુજબની જરૂરી દવાઓ લેવાનું સુચન કરે છે અને સર્જરી સાઈડના રોગો મેડીકલ ઓફિસરોને દર્દીની તપાસમાં માલમ પડે તો હોસ્પિટલમાં આવતા માનદ્ધ સર્જનોને બતાવી દવા લેવાનું સુચન કરવામાં આવે છે. જે વિભાગના ડોક્ટરો અત્રે નથી તે માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે જવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૫. એક્ષ-રે ટેકનીશ્યન :–

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ડીજીટલ એક્ષ-રે મશીન ઉપલબ્ધ છે. એક્ષ-રે ટેકનીશ્યનો દર્દીઓના એક્ષ-રે પાડી આપે છે. જે આધારે દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૬. પેરામેડીકલ સ્ટાફ :–

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સો, લેબોરેટરી ટેકનીશ્યનો, એક્ષ-રે ટેકનીશ્યનો, ડાયાલીસીસ ટેકનીશ્યનો તેઓને આનુસંગીક સેવાઓ જેવી કે,

(અ) નર્સો :–

હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓને સારસંભાળ રાખવાની ફરજ બજાવે તેમજ જુની. મેડીકલ ઓફિસરોના માર્ગદર્શન હેઠળ ઇન્જેક્શન, દવા, ગલુકોઝ ચઢાવવા જેવી કામગીરી કરે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(બ) લેબોરેટરી ટેકનીશ્યન :

રોગ પરિક્ષણ માટે આવતા દર્દીઓનાં બ્લડ યુરીન વિગેરેની વિવિધ તપાસ કરી હોસ્પિટલ ખાતે ફુલટાઈમ પેથોલોજીસ્ટના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ રીપોર્ટ તૈયાર કરે છે. જે અન્વયે દર્દીને સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(ક) ડાયાલીસીસ ટેકનીશ્યન :

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ૦૪ ડાયાલીસીસ મશીન ઉપલબ્ધ છે. અતે ૦૨ ડાયાલીસીસ ટેકનીશ્યન ફરજ બજાવે છે. જેઓ દર્દીઓને ડાયાલીસીસની જરૂરી સારવાર આપવાની ફરજ બજાવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(ઢ) કલાર્ક કમ કમ્પા. આસી. :

દર્દીઓને જોઈ તપાસી લખી આપેલ જરૂરી દવાઓ માંથી મસ્કતિ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ દવાઓ દર્દીઓને આપવી તેમજ દવાના પ્રિસ્કીપ્શનનો લખી આપવા. મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે કાર્યરત મેડીકલ સ્ટોરના દવાના બીલો પ્રિસ્કીપ્શન મુજબ છે કે કેમ તે ચેક કરવા. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(૪) સેનેટરી સબ ઈન્સ્પેક્ટર :

પોતાની ફરજ દરમ્યાન મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલમાં ફરજ બજાવતાં તમામ સફાઈ કામદારોની હાજરી પુરવી, રૂદરપુરા હેલ્પ ક્રેમ્પથી ફુલઝાહુ, બુતારા, પ્લાસ્ટીકની બેગ જેવી સાધન સામગ્રી લાવવી વખતો વખત ૨જીસ્ટર મેઇન્ટેઇન કરવું તેમજ હોસ્પિટલનો તમામ પ્રકારનો બાયોમેડીકલ વેસ્ટ ડિસ્પોઝલના નિયમોમાં દર્શાવ્યા પ્રમાણે નિકાલ કરવો. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(૬) મુકાદમ :

સેનેટરી સબ ઈન્સ્પેક્ટર દ્વારા સફાઈ કામદારોને સોપવામાં આવેલ કામગીરીનું નિરીક્ષણ કરવું. તેમજ તમામ વોર્ડમાં દરેક પાણીમાં તેઓની ગોઠવણ કરવી. પોતાની સીધી દેખરેખ હેઠળ સફાઈ કામદારો પાસે હોસ્પિટલના દરેક વિભાગોની સફાઈ અંગેની કામગીરી કરાવવાની હોય છે. તથા સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની સુચના મુજબ કામગીરી કરવી.

(૭) વોર્ડબોય અને આયા :

ઓ.પી.ડી.ની સાફ્ફ-સફાઈ, ઓ.પી.ડી. કેસની નોંધણી, ઓ.પી.ડી.માં પેશાન્ટને લાગત ચીજ વસ્તુઓ પુરી પાડવી, જરૂર પડ્યે પેશાન્ટને એક્શન-રે, લોહી ચકાસણી અર્થે લઈ જવા, દર્દીને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવું, ઓ.પી.ડી.નો સમય પુરો થયેથી પંખા, લાઈટો, બારી બારણા બંધ કરવા અને

દર્દીઓની માહિતી ટેલીફોન કાઉન્ટર પર પહોંચતી કરવી. વોર્ડમાં ડસ્ટીગ, દવા છાંટવી, કેસપેપર બનાવવા, ડ્રેસીગ મટીરીયલ્સ કાપવું, શીઝ-કબાટો સાફ્ કરવા, લીનન ગણવા, બાયોમેડીકલ વેસ્ટ જીમા કરવો, પેશન્ટને શીફ્ટ કરવા, નવા દાખલ થનાર દર્દીને સારવાર આપવામાં નર્સ તેમજ ડોક્ટરને મદદ કરવી, ઓટોકલેવ માટે ટ્રે અને ઇમ મુકવા, ઓક્સિજનના ખાલી બાટલા ભરાવવા, સ્ટેશનરી લેવા જવું, ઉપરાંત વોર્ડમાં નર્સને મદદ કરવી. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

(૬) સફાઈ કામદાર/બેલદાર :–

મુકાદમની સીધી દેખરેખ હેઠળ સફાઈ કામદારો શીફ્ટવાઈજ વોર્ડમાં ફરજ બજાવે છે. આ દરમ્યાન દર્દીઓને લાવવા લઈ જવા, દર્દીની પથારી વિગેરે વ્યવસ્થિત કરવા તેમજ વોર્ડ, હોસ્પિટલની સાફ્ સફાઈ અંગેની કામગીરીની ફરજ બજાવે છે. આ ઉપરાંત પોતાના ઉપરી અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૭. વહીવટી વિભાગ :–

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલના સંચાલન માટે વહીવટી વિભાગમાં ડે.એકાઉન્ટન્ટ, સેક્શન ઓફિસર, આસી.એકાઉન્ટન્ટ, હેડકલાર્ક, સીની.કલાર્ક, ત્રીજીશ્રેણી કલાર્ક તેમજ પટાવાળાનો સ્ટાફ કાર્યરત છે.

૧.ડે.એકાઉન્ટન્ટ :–

મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ના બીલોની ચકાસણી તેમજ હિસાબી તથા ઓડિટ ખાતાને લાગત તમામ કામગીરી પર દેખરેખ રાખવી.

૨.સેક્શન ઓફિસર :–

હોસ્પિટલનો સામાન્ય વહીવટ સુવ્યવસ્થિત અને સુચારુ ચાલે તે માટે, મહેકમની કામગીરી ઉપર દેખરેખ, તાબા હેઠળનાં કર્મચારીઓની રજા મંજૂર કરવી, વહીવટી સ્ટાફમાંથી કર્મચારી રજા ઉપર હોય ત્યારે તેમની જગ્યાએ અન્ય કર્મચારીની ગોઠવણી કરવી.ઓફિસ કામો કરાવવા અન્ય ખાતા/ જોનમાં રીપોર્ટ કરાવવા.હોસ્પિટલના તમામ કર્મચારીના ઈન્ચીમેન્ટ, રજા વિગેરે નિયમિત રીતે પાસ થાય તેની પર દેખરેખ સ્ટેશનરી, સેનેટરી સામાન માટે ઈન્ડેન્ટ ઓથોરીટી તરીકે તમામ ઈન્ડેન્ટ પર સહી કરવી. તાબા હેઠળના કર્મચારીઓની કામગીરી ઉપર દેખરેખ રાખવી.ભરણું ચેક કરવું . હોસ્પિટલમાં આવતા પેમેન્ટના તમામ બીલો ચેક કરવા, હોસ્પિટલના તમામ રેકર્ડની વર્ગીકરણ મુજબ જાળવણી કરાવવી અને રેકર્ડ નિયમિત રીતે રેકર્ડ ખાતામાં જીમા કરાવવા, ડેસ્ટોક ૨જીસ્ટર નિભાવવા સમયાંતરે કંડમ માલસામાન/રેકર્ડ/સાધનોનાં નિકાલની કામગીરી સ્ટાફ પાસે કરાવવી તેમજ હોસ્પિટલના નિભાવ/મરામતની લગતી ફરીયાદોનો લાગત અધિકારીને ધ્યાને લાવી નિકાલ કરી તેનો રેકર્ડ નિભાવવો, તેમના તાબા હેઠળના કર્મચારીને મેમો, કારણદર્શક નોટીસ, ચાર્જશીટ વિગેરે તૈયાર કરવાનું કામ બી.પી.એમ.સી. એકટના ૭૩(૩) અને ચેપ્ટર ૫(૨) હેઠળની દરખાસ્તો તૈયાર કરાવવી, ઉપરાંત હોસ્પિટલના વડા અધિકારી સુચવે તે કામગીરી કરવાની હોય છે.

૩. આસી.ઓકાઉન્ટન્ટ :–

મસ્કનિ ધર્માર્થ હોસ્પિટલ ના બીલોની ચકાસણી તેમજ હિસાબી તથા ઓડિટ ખાતાને લાગત તમામ કામગીરી પર દેખરેખ રાખવી.

૪. હેડ લાર્ક :–

હોસ્પિટલનો સામાન્ય વહીવટ સુવ્યવસ્થિત અને સુચારુ ચાલે તે માટે, સેક્શન ઓફિસરની ગેરહાજરીમાં તેઓની તમામ ફરજ ઉપરાંત, પર્સનલ એડવાન્સનું રજીસ્ટર નિભાવવું. પાર્ટીની ઈ.એમ.ડી./સીક્યુરોરીટી ડીપોઝિટ સમય મર્યાદામાં છુટી કરવી. હોસ્પિટલમાં ભાડે આપવામાં આવેલ મેરીકલ સ્ટોરની તમામ આનુસારિક કાર્યવાહી કરવી. વેપારી બીલોના પેમેન્ટ અંગેની કાર્યવાહી કરવી. હોસ્પિટલના તમામ સાધનોના મેઈન્ટનાન્સ, મરામત નિભાવની અને ખરીદેલ સાધનોની ડેડસ્ટોક રજીસ્ટર અને વપરાશી વસ્તુનું રજીસ્ટર નિભાવવું. ટેન્ડર ઈ.એમ.ડી./એસ.ડી.ને લગતી ઓડિટ ઓળજેક્શનની કામગીરી કરવી. જુના કન્ડમ થયેલ સાધનની ડિસ્પોઝ કરવાની કાર્યવાહી સેક્શન ઓફિસર સાથે સંકલનમાં રહીને કરવી.

૫. બીજી શ્રેષ્ઠી કલાર્ક :–


એસ્ટાભ્લીશમેન્ટ એટલે કે, મસ્કનિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તમામ કર્મચારીઓના પગાર, રજા, પેન્શન, રાઇટ ટુ ઈન્ફર્મેશન એક્ટ-૨૦૦૫ હેઠળ મળતી તમામ અરજી પરતે સમય મર્યાદામાં માહિતી / પ્રત્યુત્તર આપવાની કામગીરી તેમજ તે અંગેનું રજીસ્ટર મેઈન્ટાઇન કરવા, દર માસે સ્ટાફના માસ્ટર ડેટા, લીવ ડેટા, એડજસ્ટમેન્ટ ડેટા તેમજ વિવિધ પ્રકારના નાણાકીય તફાવતની ગણતરી કરવી, એલ.ટી.સી.ની ચકાસણી કરવી, હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા માનદ ડોક્ટરોના બીલ બનાવી દર માસે નાણા ચુકવવાની કાર્યવાહી, હોસ્પિટલને લાગત સાધન સામગ્રી ખરીદવા અંગેના ટેન્ડર/કવોટેશનની તમામ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી. બજેટ અંગેની કાર્યવાહીમાં મદદ કરવી. હિસાબીખાતા તેમજ ઓડિટખાતાના સંકલનમાં રહી કર્મચારીઓની સેવાપોથી અંગેની તમામ કાર્યવાહી. સરપેન્ડ થયાની કામગીરી.

૬. ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક :–

ઇનવર્ડ/આઉટવર્ડ રજીસ્ટર અપડેટ રાખવા, જુદા જુદા પરિપત્રો ઠરાવો વગેરેની ફાઈલ તૈયાર કરવી. કોમ્પ્યુટરને લગતી કામગીરી, કેસ કાઢવા, જુના કેસ કાઢવા, હોસ્પિટલના બીલોની વસુલાત કરવી, ભરણા કરવા અંગેની કામગીરી કરે છે. વિવિધ દર્દીઓને આપવામાં આવેલ બીલ રાહતો બાબત એકટની કલમ ૭૩(૩) હેઠળની દરખાસ્તો સેક્શન ઓફિસરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવા વિગેરે કામગીરી નિભાવે છે.

કલમ-૪(૧)(બી)(૩) : દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં

અનુસરવાની કાર્યવાહી :-



કલમ(૪)(૧)(બી)(૪) : પોતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો :

સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારશ્રી આદેશાનુસાર મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે આરોગ્ય સંલગ્ન તથીભી સેવાઓ/સુવિધા/માહિતી પુરી પાડવામાં આવે છે.

કલમ(૪)(૧)(બી)(૫) : કાર્યો બજાવવા માટે અથવા નિયંત્રણ હેઠળના અથવા કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને રેકર્ડ :

ધી બી. પી. એમ. સી. એક્ટ ૧૯૪૮ મુજબ હોસ્પિટલ વિભાગની કામગીરીને લાગત કલમો હેઠળ તેમજ રાજ્ય સરકારશ્રીના આદેશો મુજબ તથા સ્થાયી સમિતિ સામાન્ય સભા દ્વારા ઠરાવ્યા મુજબની કામગીરી નિભાવવામાં આવે છે.

કલમ(૪)(૧)(બી)(૬) : નિયંત્રણ હેઠળ હોય એવા દસ્તાવેજનું વર્ગીકરણ :

હોસ્પિટલ વિભાગ હસ્તકના સારવાર લેતા દર્દીઓના કેસ પેપરો, એમ.એલ.સી. કેસ પેપરો, ૭૩ (૩) હેઠળ દર્દીઓને માફી આપવામાં આવેલ હોય વગેરે દસ્તાવેજો ઉપલબ્ધ રાખવામાં આવે છે.

કલમ(૪)(૧)(બી)(૭) : નિતી ઘડતરના અથવા તેના અમલીકરણનાં સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર અને વિનિમય માટે અથવા તેના દ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ વ્યવસ્થાની વિગતો

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે.

કલમ (૪)(૧)(બી)(૮) : સલાહના હેતુઓ માટે બે અથવા બે થી વધુ વ્યક્તિઓનાં બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ વિગેરે :-

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે.

કલમ(૪)(૧)(બી)(૯) :- અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :—

અ.નં.	અધિકારી/કર્મચારીનું નામ	હોદ્દો	સરનામું
૧.	શ્રી કિરીત જી. શર્મા	સેક્શન ઓફિસર	મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ટાવર સામે, મેઈન રોડ, સુરત.
૨.	શ્રી યેતનકુમાર પી. આસમાની	બીજી શ્રેણી કલાર્ક	
૩.	શ્રી બ્રિજલ કે. સારીખડા	બીજી શ્રેણી કલાર્ક	
૪.	શ્રી પરીમલ આર. નાયક	ત્રીજી શ્રેણી કલાર્ક	
૫.	શ્રી મન્સુરી મો. નવેદ મો. આરીફ	ત્રીજી શ્રેણી કલાર્ક	
૬.	શ્રી આશાબેન કે. ડાભી	ત્રીજી શ્રેણી કલાર્ક	
૭.	શ્રી રૂપાલી ગણેશ પોર્ટકર	ત્રીજી શ્રેણી કલાર્ક	
૮.	શ્રી જાગૃતિબેન વિપુલકુમાર ગજેરા	ત્રીજી શ્રેણી કલાર્ક	
૯.	શ્રી હેતલ એસ. પટેલ	ત્રીજી શ્રેણી કલાર્ક	

કલમ(૪)(૧)(બી)(૧૦):અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણા :—

અ.નં.	અધિકારી/કર્મચારીનું નામ	હોદ્દો	પગાર ધોરણ
૧.	શ્રી કિરીત જી. શર્મા	સેક્શન ઓફિસર	૮૩૦૦-૩૪૮૦૦ ૪૪૬૦૦-૧૪૨૪૦૦
૨.	શ્રી યેતનકુમાર પી. આસમાની	બીજી શ્રેણી કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦ ૪૪૬૦૦-૧૪૨૪૦૦
૩.	શ્રી બ્રિજલ કે. સારીખડા	બીજી શ્રેણી કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦ ૩૪૪૦૦-૧૧૨૪૦૦
૪.	શ્રી પરીમલ આર. નાયક	ત્રીજી શ્રેણી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૨૫૫૦૦-૮૧૧૦૦
૫.	શ્રી મન્સુરી મો. નવેદ મો. આરીફ	ત્રીજી શ્રેણી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૬૦૦-૬૩૨૦૦
૬.	શ્રી આશાબેન કે. ડાભી	ત્રીજી શ્રેણી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૬૦૦-૬૩૨૦૦
૭.	શ્રી રૂપાલી ગણેશ પોર્ટકર	ત્રીજી શ્રેણી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૬૦૦-૬૩૨૦૦
૮.	શ્રી જાગૃતિબેન વિપુલકુમાર ગજેરા	ત્રીજી શ્રેણી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૬૦૦-૬૩૨૦૦
૯.	શ્રી હેતલ એસ. પટેલ	ત્રીજી શ્રેણી કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦ ૧૬૬૦૦-૬૩૨૦૦

કલમ(૪)(૧)(બી)(૧૧) : તમામ યોજનાઓ સુચિત ખર્ચ , ચુકવેલ નાણા પરના અહેવાલોની વિગતો દર્શાવતુ અંદાજપત્ર :—

બી.સી.એન.ટી. વાઈડી માહિતી www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

કલમ (૪)(૧)(બી)(૧૨) : ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને ઓવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો :—

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

કલમ(૪)(૧)(બી)(૧૩) : છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :—

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

કલમ(૪)(૧)(બી)(૧૪) : ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતીઓને લગતી વિગતો :—

સુરત મહાનગરપાલિકા જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે જે સુરત મહાનગરપાલિકાની www.suratmunicipal.gov.in પર ઉપલબ્ધ છે.

વર્ષ	હુકમની સંખ્યા
૨૦૧૫	૨
૨૦૧૬	૧
૨૦૧૭	૧
૨૦૧૮	૩
૨૦૧૯	૨
૨૦૨૦	૦
૨૦૨૧	૧
૨૦૨૨	૧
૨૦૨૩	૧

કલમ(૪)(૧)(બી)(૧૫) : જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલયની વિગત :—

સુરત મહાનગરપાલિકા જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે.

કલમ(૪)(૧)(બી)(૧૬) : જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દા અને બીજી વિગતો :—

સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે

મુકવામાં આવેલ છે. જે મુજબ મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતેની માહિતી નીચે પ્રમાણે છે.

અ.નં. કર્મચારીનું નામ હોદ્દો ટેલીફોન નંબર

૧. ડૉ.એચ.કે.સોધરવા	સીની.સ્થાનિક વૈ. અમલદાર	અપીલ અધિકારી	૮૭૨૪૩૪૫૪૭૮
૨. કે.જી.શર્મા	સેક્શન ઓફિસર	માહિતી અધિકારી	૮૭૨૬૬૮૨૮૮૮

કલમ(૪)(૧)(બી)(૧૭) : ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :-

અરજી

- (૧) એપ્રિલ થી જુન -૨૦૨૩ રજીસ્ટર નમૂનો-૧
- (૨) જુલાઈ થી સપ્ટેમ્બર -૨૦૨૩ રજીસ્ટર નમૂનો-૧
- (૩) ઓક્ટોબર થી ડિસેમ્બર -૨૦૨૩ રજીસ્ટર નમૂનો-૧
- (૪) જાન્યુઆરી થી માર્ચ -૨૦૨૪ રજીસ્ટર નમૂનો-૧

૫૦૧૨૫૨ નંબર
20236000027
સુરત મહાનગરપાલિકા



મોકલનાર : અપીલ અધિકારી અને
સી.ની.સ્થા.વે.અમલદાર
મસ્કતિ ઘર્માર્થ હોસ્પિટલ,
ટાવર રોડ, સુરત.
ટેલી.નં. ૦૨૬૧-૨૪૨૦૪૧૨

અપીલ અરજી નં. ૨ તા. ૦૯/૦૮/૨૦૨૨
MCH/TN/03/8/2022

અરજદાર : - શ્રી હિપકભાઈ પટેલ

સામાચારીનામાં : - જાહેર મારીતી અધિકારી અને સેક્રશન ઓફિસરશી, મસ્કતિ ઘર્માર્થ હોસ્પિટલ

ફરીયાદ ની હકીકતાના : - આર.ટી.આઈ. એક્ટ હેઠળ RCPS એક્ટ ૨૦૧૩ સંબંધી મુદ્દા નં. ૧૩૩૧ ની માહિતી પુરી પાડવા બાબત.

૧. ઘ ગુજરાત રાઈટ ઓફ સીટીઝન્સ ટુ પબ્લિક સર્વિસ એક્ટ-૨૦૧૩ સંબંધી તા. ૧૫/૦૪/૨૦૧૩ થી ગુજરાત સરકારશ્રીએ જાહેર કરેલ અધિનિયમ મુજબ અમેને આપણીના સત્તામંડળના ફરીયાદ નિવારણ અધિકારીશ્રીનું નામ, સરનામું, ટેલીફોન નંબર, ઈ-મેલ એડ્રેસ, ફેસ્ટિમાઈલ નંબરની માહિતી તથા આ માહિતી જાહેર-પ્રદર્શિત કર્યાની તારીખની માહિતી.
૨. ફરીયાદ સ્વીકાર્ય બદલ આપના સત્તામંડળ દ્વારા ફરીયાદને જે પહોંચથી પહોંચમાં તારીખ, સમય, સ્થળ, ફરીયાદ નંબર, ફરીયાદ સ્વીકારણાર વ્યક્તિનું નામ અને ફરીયાદ નિવારણ કરવાની સમય મર્યાદા નિર્દિષ્ટ કરી દર્શાવેલ છે તે પહોંચના નમૂનાની પ્રમાણિત નકલની માહિતી.
૩. RCPS ACT -2013 ની કલમ ૨ ના ખંડ(૫) માં જગ્ગાઈ કર્યા મુજબ આપણીની કચેરીની ફરીયાદને લગતા ફરીયાદ નિવારણ અંગે જાહેર કરવામાં આવેલા મુકરર અધિકારીશ્રી ના નામ, હોદ્દો, સરનામું, અમેનો ઈ-મેલ એડ્રેસ, ફોન નંબરની માહિતી.
૪. તા. ૧૫/૦૪/૨૦૧૩ થાથ RCPS ACT -2013 પેટાકલમ ૨૪ (૧) (૨) મુજબ આપણીની કચેરીમાં નોંધવામાં આવેલ તમામ ફરીયાદોની વર્ષવારીના સંખ્યા અંકડાકીય માહિતી.
૫. એકટના પ્રકરણ ૪ પેટાંડ ૮() મુજબ આજદીન સુધી મુકરર સત્તાધિકારીશ્રીને મોકલેલ તમામ રીપોર્ટની પ્રમાણીત પત્રોથી માહિતી.
૬. આપણીની કચેરીના ફરીયાદ નિવારણ અધિકારીના નિર્ણયથી નારાજ થઈ મુકરર સત્તાધિકારીશ્રીને કરવામાં આવેલી અપીલોની સંખ્યા અંકડાકીય માહિતી.
૭. રાજ્ય અપીલ સત્તામંડળ અને રાજ્ય અપીલ સત્તા ધિકારીશ્રીના નામ, સરનામા, ઈ-મેલ, ફોન નંબરની માહિતી.
૮. RCPS ACT -2013 ગુજરાત સરકારશ્રીના તા. ૧૫/૦૪/૨૦૧૩ ની સુચનાનું નોટીફિકેશન પાલન કરવા કરવાની જવાબદારી ફરજ સંભાળતા આપના સેવા સત્તામંડળના જાહેર સેવકોના નામ, હોદ્દો, સરનામાની માહિતી.
૯. આપણીની કચેરીમાં RCPS ACT -2013 નો અમલના કર્યા-કરાવ્યાના કેસમાં ઉપરી કચેરીમાં ફરીયાદ કરવા બાબતે જે અધિકારી, ઉચ્ચ સેવા સત્તામંડળ અદાલતમાં અરજદાર-ફરીયાદી દાવા પ્રતીદાવા દાખલ કરી શકે એ સુનિશ્ચિતતાથેલ હોય તે અધિકારી, ઉચ્ચ સેવામંડળ, અદાલતના નામ, સરનામાની માહિતી.
૧૦. આપણીની કચેરીના માહિતી અધિકારીશ્રી પ્રથમ અપીલ અધિકારીશ્રીના નામ-હોદ્દો સરનામા, ફોન નંબર, ઈ-મેલ નંબરની માહિતી આર.ટી.આઈ. સેલ એકાઉન્ટ નામ, એકાઉન્ટ નંબરની માહિતી આપશો.
૧૧. મુદ્દા નં. ૧૩૩૧ માં દર્શાવેલ માહિતી સાચવવાની, નિભાવવાની વખતોવખત અપેટ કરવાની જવાબદારી સંભાળતા અધિકારીનો નામ, હોદ્દો અને સરનામાની માહિતી. તમામ મુદ્દા સંબંધી જવાબદાર અધિકારીના નામ, હોદ્દાની માહિતી વર્ણવાર આપવી.

જાહેર માહિતી અધિકારી અને સેક્રશન ઓફિસરશી મસ્કતિ ઘર્માર્થ હોસ્પિટલ તરફથી અરજદારશ્રીએ સમય અવધિમાં પત્ર ક્રમાંક આઉટવર્ક નં. એમ.સી.એચ/આઉટ/૫૪૩, તા. ૨૦/૦૭/૨૦૨૨થી લાગત મુદ્દા નં. ૧૦ અંગે "જાહેર માહિતીઅધિકારીશ્રી આર.આર.પટેલ (II-કલાક્ટ) ટેલી.નં. (૦૨૬૧)૨૪૨૦૪૧૨, ઈ-મેલ : maskatihospital123@gmail.com તથા પ્રથમ અપીલ અધિકારીશ્રી ડૉ.એચ.કે.સોધરવા સી.ની.સ્થાનિક વે.અમલદારશી, મસ્કતિ ઘર્માર્થ હોસ્પિટલ ટેલી. નં. (૦૨૬૧)૨૪૨૦૪૧૨, ઈ-મેલ : maskatihospital123@gmail.com" એ મુજબનો પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ છે.

સદર અરજી અન્વયે જાહેર માહિતી અધિકારી અને સેક્શન ઓફિસરશી મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ તરફથી મળેલ પ્રત્યુત્તર થી નારાજ થઈ તા.૦૧/૦૮/૨૦૨૨ ના રોજ અપીલ અધિકારીશી ને ઉદ્દેશીને સેન્ટ્રલ ઝોન માં અપીલ કરેલ જે અતેની કચેરીએ તા. ૦૩/૦૮/૨૦૨૨ ના રોજ મળેલ છે.

ઉપરોક્ત બાબતે તા.૧૭/૦૮/૨૦૨૨ ના રોજ રાખેલ સુનાવણીમાં અરજદારે તેઓની લેખિતમાં રજુઆત કરેલ છે. જ્યારે જાહેર માહિતી અધિકારીએ લાગુ પડતા મુદ્દાઓનો જવાબ આપેલ છે જે, યોગ્ય હોવાનું જણાવેલ છે. આમ, અરજદારશીની મૂળ અરજી, અપીલ અરજીમાં લેખિત રજુઆત તથા જાહેર માહિતી અધિકારી અને સેક્શન ઓફિસર મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ તરફથી ઉક્ત વિગતે કરેલ લેખિત પૂર્તતા રીપોર્ટ વિગેરે બાબતો ધ્યાને લઈ નીચે મુજબનો હુકમ કરી અપીલ અરજીનો નિકાલ કરવામાં આવે છે.

—ઃહુકમઃ—

અરજદારશી તા.૨૪/૦૬/૨૦૨૨(આઈ.ડી.નં. ૪૩૪) ની આર.ટી.આઈ ની અરજી થી માંગવામાં આવેલ માહિતી બાબતે જાહેર માહિતી અધિકારી અને સેક્શન ઓફિસર મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ દ્વારા મુદ્દા નં. ૧૦ પરતે પુરી પાડવામાં આવેલ લાગત માહિતી અવલોકનમાં લેતા તે ઉચિત હોવાનું જણાય છે. વધુમાં આપશ્રીની લેખિત રજુઆત નં. મુદ્દા નં.૭ મુજબ સુનાવણી નં. રોજ કામની પ્રમાણિત નકલ આ સાથે સામેલ છે. જે ધ્યાને લેતા અરજદારશી ની પ્રથમ અપીલ અરજી પરતે વધુ કોઈ કાર્યવાહી કરવાનું જણાનું ન હોય, પ્રથમ અપીલ અરજીનો નિકાલ કરવામાં આવે છે.

અરજદારશી સદર હુકમથી નારાજ હોય તો ગુજરાત માહિતી આયોગ, કર્મયોગી ભવન, રાજ્યક્ષાની કચેરીએ, હોડ નં. ૧, બીજો માળ, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર નં. ૧૦ એ, ગાંધીનગર ઘાતે બીજી અપીલ કરી શકે છે. અરજદાર ઈચ્છે તો આયોગની વેબસાઈટ <https://gic.gujarat.in/default.aspx> ઉપર Online પણ કરી શકે છે.

નં.એમ.સી.એચ./આઉટ/૭૨૧
તા.૨૫/૮/૨૦૨૨

૧૮/૮/૨૦૨૨
૨૦૨૪/૮/૧૯

ડૉ. એચ.કે.સોધરવા
અપીલ અધિકારી અને સીની.સ્થાનિક.વૈ.અમલદાર
મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ

(૧) જાહેર માહિતી અધિકારીશી અને સેક્શન ઓફિસરશી મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ પ્રતિ..... જાણ તથા અમલ સારુ.